



તંત્રીની કલમે આ પત્ર... ‘સમર’ કહેતાં ઉનાળો શરૂ થઈ ગયો છે. ભારતના ઉનાળાના હવાલો દુઃખદ છે. અત્યાર સુધીમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી ૨,૨૦૦ માણસો મૃત્યુ પામ્યાના સમાચાર છે. અમેરિકામાં ‘સમર’ ટાઈમમાં કેટલા દિવસ ૧૦૦ ફેરનહીટ જેટલું તાપમાન રહ્યું તે ઉપરથી આ વર્ષના ‘સમર’નું મૂલ્યાંકન થાય છે. અને ૧૦૦ કે તેથી વધુ ડીગ્રી હોય તો લોકો બહાર જવાનું ટાળે છે. આપણને આપણા દેશનો-ગુજરાતનો અનુભવ છે કે, વર્ષની ત્રણ ઋતુઓ આવે-શિયાળો, ઉનાળો અને ચોમાસુ, નિયમિત રીતે દર વર્ષે સમયસર શરૂ થાય અને એની મુદત પ્રમાણે પૂરી થાય. હવે એવું થતું નથી. હવે તો અ ઋતુઓ પણ સંકટ લઈને આવતી થઈ છે. તાજેતરમાં ભારતના પડોશી દેશ ‘નેપાળ’માં ધરતીકંપે તારાજ સર્જ્યું.

આપણા દેશ-અમેરિકામાં પણ કેટલાંયે રાજ્યોમાં ભયંકર વાવાઝોડાં અને વરસાદી પૂર વારંવાર તારાજ સર્જે છે. યુએસએમાં જાન્યુઆરીથી માર્ચ-એપ્રિલ સુધી બારે હિમવર્ષાનું સંકટ અને એપ્રિલ જૂન દરમિયાન વાવાઝોડા સાથે ભારે વર્ષાથી થતી તબાહી અનેક લોકોને બેઘર બનાવી દે છે. જનમાલનો વિનાશ સહન કરવા મુશ્કેલ છે. કુદરતી આફતો અને હવે માનવસર્જિત આફતોએ સમગ્ર વિશ્વની પ્રજાને મૂંઝવણમાં મૂકી દીધી છે.

આવાં કુદરતી અને માનવસર્જિત સંકટોની સીધી અસર કુટુંબજીવન ઉપર આવી પડે છે. આ સંકટો કુદરતી સંપત્તિનો નાશ કરે છે, જીવનનિર્વાહની ચીજવસ્તુઓની અછત ઊભી થાય છે. આવી આફતગ્રસ્ત પ્રજાને સહાય કરવાની પણ જાણે હોડ જામે છે, તો બીજી વરવી વાસ્તવિકતા એ પણ છે કે, સંકટગ્રસ્ત વિસ્તારોમાં સ્થાનિક વેપારીઓ જીવનજરૂરી ચીજવસ્તુઓ દસ-પંદરગણા ભાવથી લૂંટ ચલાવે છે. જાણે માનવતા મરી પરવારી હોય. કડાણતા એ પણ છે કે, જે વિસ્તારમાં સંકટ આવી પડ્યું હોય અને જે નસીબદાર લોકોને ખાસ નુકસાન વેઠવું પડ્યું ન હોય, તેઓ તારાજ થયેલાં ઘરબારમાં લૂંટ ચલાવતા હોય છે!

પ્રશ્ન આવીને ઊભો રહે છે-વીસમી સદીમાં હરણફાળ વિકાસના માહોલમાં પ્રજાની માનવતાને થયું છે શું? મનુષ્યમાં પડેલી હકારાત્મક અને નકારાત્મક વૃત્તિમાંથી કાયમી કે સાતત્યપૂર્વક કેમ હકારાત્મક વૃત્તિ હંમેશાં અમલમાં મૂકાતી નથી? મનુષ્યની કે જનસમૂહની નકારાત્મક વર્તણૂકને આપણે બદલી શકતા નથી. પણ મનુષ્ય પોતે ઈચ્છે તો.... પોતાની નકારાત્મક વૃત્તિ ઉપર રોક લગાવી શકે છે. આ માટે મનુષ્યે અવારનવાર ‘આત્મમંથન’ કરવું જરૂરી છે.

એક માણસ જો નકારાત્મક વૃત્તિને રોકી શકે, તો જરૂર હકારાત્મક બદલાવ લાવી શકે! નેપોલિયનનું લશ્કર જંગલની ઝાડીમાં અટવાય પડ્યું હતું. નેપોલિયને ઉમદા સૈનિકોને કોઈ રસ્તો શોધવા મોકલ્યા. થોડા વખત પછી તેમણે હેવાલ આપ્યો કે, ઝાડીમાંથી નિકળવાનો એક જ ઉપાય છે, પણ એવો કઠીન છે કે, એ માર્ગથી એક જ સૈનિક આગળ વધી શકે તેમ છે. નેપોલિયને હુકમ કર્યો, જંગલની ઝાડીમાં અટવાયેલું લશ્કર એ રસ્તેથી બહાર નીકળવા તૈયાર થાય-નેપોલિયને ત્યારે કહેલું, “જ્યાંથી ફક્ત એક સૈનિક પસાર થઈ શકે ત્યાંથી સમગ્ર લશ્કર પણ આગળ વધી શકે.”-બસ, સ્વયં ફક્ત એક માણસ પોતાના જીવનમાં હકારાત્મક અભિગમ અપનાવે તો પ્રજા એવા અનેક હકારાત્મક લોકો વડે અપેક્ષિત પરિવર્તન લાવી શકે! સ્વનો હકારાત્મક બદલાવ શક્ય છે, સમૂહના બદલાવની શક્યતા મુશ્કેલ છે. અને તેથી સ્વના એકના હકારાત્મક બદલાવથી, જેમ નેપોલિયને કહ્યું હતું તેમ અન્ય તમામ સૈનિકોની જેમ-સ્વબદલાવ કરનારા અનેક લોકોની સામૂહિક અસરથી વિશ્વભરમાં નકારાત્મક વર્તણૂક કરીને અનેક લોકોને સંકટમાં મૂકવાની પરિસ્થિતિમાં સમગ્ર પ્રજાના હિતમાં પરિવર્તન લાવી શકાય!

આત્મચિંતનનો સંબંધ ‘પવિત્ર આત્મા’ સાથે રહેલો છે. “ત્યાં અચાનક પવન જોરથી વાતો હોય તેવો પવન આવ્યો.. તે આખું ઘર તેનાથી ભરાઈ ગયું; અનેક જવાળાઓ જેવી જાલો દેખાઈ, અને તે વહેંચાઈ જઈને દરેકના માથા ઉપર એકએક સ્થિર થઈ. તે બધામાં ‘પવિત્ર આત્મા’નો સંચાર થયો.” (પ્રેષિતોનાં ચરિતો: ૨: ૨-૪) યોએલ પ્રબોધકે ભાખ્યા મુજબ “છેલ્લા દિવસોમાં આમ બનશે; હું બધા માણસોમાં મારા આત્માનો સંચાર કરીશ.” આ બધું દુનિયાના અંત સંબંધે પવિત્ર પિતરે કહ્યું હતું. પવિત્ર પિતરે એમ પણ કહ્યું હતું “હદયપલટો કરો.” (પ્રેષિતોનાં ચરિતો: ૨: ૩૮) આ માટે દુનિયાના અંત સુધી રાહ જોવાની? આપણને ક્યાં ખબર છે કે, દુનિયાનો અંત ક્યારે છે? આત્મ ચિંતન આત્મિક માર્ગદર્શન આપશે. આત્મ ચિંતન કરનાર પ્રભુ તરફથી પ્રેરણા મેળવશે. આત્મ ચિંતન પ્રાર્થનામાં દોરશે. કોઈ લેખકે કહ્યું છે, “પ્રાર્થના જીવનનું જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે.”

મનુષ્યની ચિંતનાત્મક પ્રાર્થના ‘પવિત્ર આત્મા’ના પ્રભાવથી તેનામાં હકારાત્મક હૃદયપલટો લાવી શકે છે. જેથી એકલ મનુષ્યની હૃદયપલટાની પ્રક્રિયા જ્યારે અનેકોની બની જાય તો “પૃથ્વીની બધી પ્રજાઓ ઈશ્વરના આશીર્વાદ પામશે.” (પ્રે. ચ.-૩:૨૫) હકારાત્મક હૃદયપલટો જીવનને દિવ્ય અને સનાતન માર્ગે લઈ જાય છે, જેમાં સુખ-શાંતિ અને સ્વસંતોષ પ્રાપ્ત થાય છે. માર્ગ કપરો છે, સહેલો નથી, પણ આત્મ ચિંતન સુખ-શાંતિના માર્ગે લઈ જવાનું કાર્ય કરે છે.

સ્વને હકારાત્મક વલણો તરફ બદલવું વ્યક્તિના પોતાના હાથમાં છે. કુદરતી અને મનુષ્ય સર્જિત સંકટોનો ઉપાય-સ્વના હકારાત્મક પરિવર્તનમાં રહેલો છે! હર એક નવો દિવસ પ્રભુ આપણને આપે છે. દિવસનાં અનેકવિધ કામોમાં આપણે વ્યસ્ત રહીએ છીએ. દિવસ દરમિયાન અનેક નિર્ણયો આપણી પોતાની ઈચ્છાથી લેતા હોઈએ છીએ. આપણા વિચારો, આપણી વાણી અને આપણું વર્તન દિવસભર ‘હકારાત્મક’ રહે તે આપણા પોતાના હાથમાં છે. દિવસ દરમિયાન આપણાથી કશું પણ એવું ન થાય કે, અન્યને તે સંકટમાં મૂકી દે. બસ, આ પ્રકારની વિચારસરણી મુજબનો આપણો એક દિવસ પસાર થાય, અને જિંદગીભર આપણા બધા દિવસો આ પ્રકારના હોય, તો આપણા જેવા અનેકોની આવી જીવનરીતિ વિશ્વમાં સંકટોને આવતાં રોકવાનું કામ કરશે! નિર્ણય આપનો હોવો જોઈએ! ‘પવિત્ર આત્મા’ આપને દોરશે! તૈયાર છો?



ઉત્તમ પુસ્તક બાઈબલ-ઈલા જોબર્ટ ક્રિશ્ચિયન (Union City, NJ)

શું આપે સારું પુસ્તક વાંચ્યું છે? મને ખાતરી છે કે, આપણે જરૂર સારાં પુસ્તકો વાંચતા હોઈએ છીએ. અને તેમાંથી ઘણો આનંદ અને સંતોષ મેળવતા હોઈએ છીએ. નાના હતા ત્યારે બાળવાર્તાઓ વાંચવી કે મોટાં પાસેથી સાંભળવી ઘણી જ ગમતી. જેમાં શૌર્ય, સાહસ હોય, હાસ્ય અને આશ્ચર્યકારક નવું નવું જાણવાની ઈતેજારી હોય. તે વાંચી, સાંભળી, સમજી સંતોષ પામવા સાથે અલૌકિક આનંદ પ્રાપ્ત કરવાનો હેતુ હતો. બાળપણમાં ઝગમગ, બાલ સંદેશ, ત્રિકોણીયા બેચાર વાળ લટકતી દાઢીવાળા મીયાં ફૂસકી કે ગોલીબાર-ચક્રમ, આજે પણ ખમાસા ગેટ, અમદાવાદ, પાસે આવેલી ઓફિસની બહાર લટકતું ચક્રમનું પોસ્ટર યાદ કરી મુખ પર સ્મિત રેલાઈ જાય છે. બાળ સાપ્તાહિકો ઘરમાં આવે ત્યારે ભાઈ-બહેનો પ્રથમ વાંચવા માટે લડાલડ કરે, ઝૂંટવીને વાંચવા માટે તલપાપડ થઈ જઈએ. વાચનની ભૂખ સામાન્ય રીતે દરેક મનુષ્યમાં આમ બાળપણથી જ વિકસતી રહે છે.

વાચનની ભૂખથી જે વાંચીએ તેમાં આનંદ, સલામતી, દિવાસો અને એવા અનેક પાઠો શીખવા મળતા. કુદરત સાથે કુદરતી નિજનંદ પ્રાપ્ત કરી હાસ્ય રેલાવતાં શાંતિનું વચન પ્રાપ્ત કરતા. “મારી શાંતિ હું તમને આપું છું, જેમ જગત આપે છે તેમ હું આપતો નથી. તમારા હૃદયને વ્યાકુળ ન થવા દો અને બીવા પણ ન દો” (યોહાન: ૧૪: ૨૭) કિશોરવસ્થામાં વાર્તાઓના વાચનથી મળતી શાંતિ “બાઈબલ”નાં આ વચનથી આજે સમજાય છે.

સન્ડે સ્કૂલમાં જઈએ ત્યારે બાળવાર્તાઓ સાંભળી બીજા રવિવારે જવાની ઉત્સુકતા જગાડે. યુસુફ અને તેના ભાઈઓની વાર્તા, યૂનાની વાર્તા-માછલીના પેટમાં કેવો સપડાયો? ઈસુએ ક્યા ક્યા ચમત્કારો કર્યા? દર રવિવારે નવી વાર્તા સ્કૂલમાં શાસ્ત્રની પીરિયડ આવે અને ડેલીબેન વ્યાસ (માસી) વાર્તાઓનો પટારો ખોલે. બેચાર અઠવાડિયાં સુધી સામસૂનની વાર્તા ચાલે, દાઉદ રાજા અને શાઉલ રાજા આવે, એસ્તર રાણી ને રૂથ આવે, આમ આતુરતાથી શાસ્ત્રના પીરિયડની રાહ જોઈએ. એમની વાર્તા કહેવાની શૈલી મંત્રમુગ્ધ કરી દેતી! આ લેખ જ્યારે વાંચશો ત્યારે આપનાં બાળપણનાં આવાં જ સ્મરણો જરૂર વાગોળશો, એની મને ખાત્રી છે. નાનપણથી જ આ બધું જીવનઘડતરના પાયામાં પડેલું છે. જીવનની ઈમારતનું ચણતર તો આમ ધીમેધીમે વાંચતાં-સાંભળતાં થયા જ ક્યું. મજબૂત પાયા પર જીવનનું ઘડતર સારાં પુસ્તકોના વાચનથી ઘડાતું ગયું. ત્યાર બાદ ઘર અને સમાજે ટીપીટીપીને ઘડતર કર્યું. આપણને પોખ્યા અને આત્માને તાજો કર્યો.

ભજન સંગ્રહના ગીત નં. ૨૨૦

“શાસ્ત્ર પવિત્ર ખરો ભંડાર જ્ઞાન સનાતન ત્યાં મળનાર;
છે મુજ મૂળ તારું ત્યાં જ્ઞાન, છે મુજ જાત તારું ત્યાં ભાન.”

સ્ત્રીઓને મન પુસ્તકો એમનો શ્વાસોરછવાસ હોય છે. પુસ્તકોમાંથી સારું સારું ભેગું કરવાનું, પાકા શાસ્ત્ર હોય તો તેમાંથી નવી નવી સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી ઘરનાં સૌ તૃપ્ત કરવાં, ‘ક્રાફ્ટબુક’ હોય તો ‘શો પીસ’ બનાવી ઘરને શણગારે. “બાઈબલ” વાંચે ત્યારે આત્મિક ભૂખ સંતોષે અને જીવનનો રાહ મળે. પ્રભુનાં વચનો હૃદયને સ્પર્શે ત્યારે આત્માથી અને સત્યતાથી આત્મિક અને અનંતકાલિક સુખ અનુભવે. તેનાં વચનો ધ્વારા આપણે શું શીખીએ છીએ? “બાઈબલ” દર્શાવેલી જેમ આપણને આપણું સત્ય સ્વરૂપ સમજાવે છે. સામેની વ્યક્તિને ઓળખવાની શક્તિ આપે છે. પોતા માટે સ્વને ઓળખી સાચી વ્યક્તિ બનવાના ઘડતરમાં પ્રભુનાં વચનો રોજરોજ બળ પૂરું પાડે છે. પ્રભુએ બેધારી તલવાર જેવાં જીવંત વચનો આપ્યાં છે.-

“દુનિયામાં સબસે પ્યારી પુસ્તક “બાઈબલ” પઢે જો,
ઉસકો રોજબરોજ કામમાં ખતરા કોઈ ન હો!

ઓહ! દુનિયામાં સબસે પ્યારી પુસ્તક “બાઈબલ”!-કેટલું અદ્ભૂત ગાન! જે આપણા માટે અજબ શક્તિ અને ઈંધણ પૂરું પાડે છે. પરબીડિયામાં છૂપાયેલ અત્તરની સુગંધ જેવાં “બાઈબલ”નાં વચનો આત્મિક પોષણ આપે છે. સન્ડે સ્કૂલમાં સૌપ્રથમ “બાઈબલ”ની ભેટ મળી હતી, જે આત્મિક ખજાનો મળ્યા બરોબર હતી, ત્યારે કિંમત ન હતી પણ આજે અદ્ભૂત મોતી સમાન વચનોની કિંમત સમજાય છે. ભજન સંગ્રહના ગીત નં. ૨૨૨;

“મારે માટે ફરીથી આ અજબ જીવંત શબ્દો;
જોવા દે તેમની સુંદરતા, અજબ જીવંત શબ્દો;
જીવંત, સુંદર શબ્દો, ફરજ, વિશ્વાસ શીખવો.”

ખૂબ જ સુંદર અને પ્રકાશિત ઉત્તમ પુસ્તક “બાઈબલ” આજે આપણા હાથમાં છે. જે જિવવા માટે ગરજ પૂરી પાડે છે. “મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજો ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડો.” (ફિલીપી: ૪: ૧૯)

‘ગીતશાસ્ત્ર’ના પુસ્તકમાં દાઉદભક્ત આપણને જીવનના દરેક સમય અને સંજોગોમાં પ્રભુનો આભાર માનવો, તેની આધીનતામાં રહેવું, દુ:ખદર્દમાં પ્રભુ આપણો સતત નિગેહબાન છે. તેનાં વચનોથી જીવનના તાર ઝળઝળી ઊઠે છે અને તેમાંથી મધુર સંગીત વહી શકે. દરેક સંજોગોમાં અને દરેક પરિસ્થિતિમાં

“બાઈબલ”નાં વચનો આપણને સાંભળવા માટે પૂરતાં છે.

“તું મરણ પર્વત વિશ્વાસુ રહે અને હું તને જીવનનો મુગટ આપીશ.” (પ્રકટીકરણ: ૨: ૧૦) બહારખુશી શોધવાની નથી. પ્રભુએ આપણામાં સુંદર સ્વર્ગીય આત્મા મૂક્યો છે. ફક્ત આજે તેને ઓળખવાનો છે. શું આ સુંદર પુસ્તક ‘બાઈબલ’ આપણા હાથમાં છે તેને માટે પ્રભુનો આભાર માનીશું? આજે આ જીવંત વચનોનો ઉપયોગ કરીશું?-

“વંદન પ્રભુજી હોજો અમારાં, આપ્યાં અદ્ભૂત વચનો તમારાં,
સુંદર શબ્દો, અજબ શબ્દો, અજબ જીવંત શબ્દો.”

આંખનાં પલપલિયાં - જોયસી ક્રિશ્ચિયન (Union City, NJ) (201) 864-4816



નાનપણમાં હું અતિ શરમાળ હતી, મારી સામે જો કોઈ પાંચ સેકન્ડ માટે પણ એકીટસે જોઈ રહે તો મારી આંખમાં પાણી આવી જતું. ઘરમાં મારી આ નબળાઈ બધાંને ખબર હતી. ખાતરી કરવા ઘણીવાર અખતરા પણ કરી જોતાં. આંસુ માંડમાંડ રોકી રાખવા યત્ન આદર્યો હોય ત્યાં જ કોઈ ખળભરી રીતે કહે, “જો.. જો. એ પલપલિયાં ટપકવા માંડ્યાં.” શબ્દો સાંભળતાં વેંત જ મારા ગાલ પર અશ્રુ સરી પડે. ખેર, આંસુ માટે ગીતો, કાવ્યો, અલંકારિક ભાષામાં ઘણા વિવિધ શબ્દો વપરાયા છે.

અશ્રુ તથા પલપલિયાં શબ્દો ઉપરોક્ત લખાણમાં આપણે જોઈ ગયા. હવે “ખ્રિસ્તી ભજન સંગ્રહ”માં ગીત નં. ૩૮૮ના બીજા શ્લોકની એક લાઈન વાંચશો તો એમાં “પડે નીર આંખથી તારી, ઈસુને કહે ઈસુને કહે.”-આ પંક્તિમાં ‘આંસુ’નો બીજો શબ્દ ‘નીર’ મળી આવે છે. જૂનાં ફિલ્મી ગીતોમાં પણ આંસુ માટે જુદાં જુદાં કલ્પનાચિત્રો મળી આવે છે,

“આંસુ સમઝકે ક્યોં મુઝે આંખસે તૂમને ગીરા દિયા,

મોતી કિસકે પ્યારકા મિટ્ટીમાં ક્યોં મિલા દીયા”-અહીં આંસુ માટે ‘મોતી’ શબ્દ વપરાયો છે અને ‘આંસુ’ને ‘મોતી’ની ઉપમા આપવામાં આવી છે. જ્યારે બીજા એક ગીતમાં “તેરી આંખકે આંસુ પી જાઉં, એસી મેરી તકદીર કહા”-માં ગાનાર ‘આંસુ’ શબ્દ વાપરે છે. (આ ગીત સાંભળું છું ત્યારે એમ જણાય કે ગાનારો બિચારો રણમાં પાણીની અછતવાળો લાગે છે. અથવા એટલો મુકલિસ કે ગરીબ છે કે પાણી પણ વેચાતું ન લેવાય તેથી માથુકાનાં આંસુ પીવાની વાત કરતો લાગે!)

આંખમાં આંસુ ક્યારે આવે?: કંઈ કચરો આંખમાં પડે, મરચું ઊડે, કાંઈ ખૂંચે, આંજણી થાય કે દુ:ખ સાંપડે તેવા સમયે આંસુનો પ્રવાહ અસ્ખલિતપણે વહે. ગૂહિણીઓ અથવા રાંધનારાઓને ડુંગળી સમારતાં આંસુ સરી પડે.

આ વિષય વિસ્તૃતપણે આલેખી શકાય. ચાલો આપણે મૂળ ચર્ચા પર ઉતરીએ. શાસ્ત્ર એટલે “પવિત્રશાસ્ત્ર બાઈબલ:માં પોક મૂકીને રડનાર પ્રથમ સ્ત્રી હાગાર, ઈબ્રાહીમની ઈજિપ્થન દાસી હતી. તેના પોકા મૂકીને રડવાનું કારણ જોઈએ તો તેનો તેર-ચૌદ વર્ષનો દીકરો રણની ધગધકતી રેતીમાં તરસ લાગતાં પાણી ન મળવાથી તરફડતો જણાય છે. માતા તરફ હાગાર બૂરા સંજોગોનો શિકાર થઈ છે. રણમાં પાણી ઉપલબ્ધ નથી. દીકરો તરફડે, માતાની નજર ક્યાંથી આ હાલત સાંખી શકે? આ માતાનું પોક મૂકીને રડવું, એ એની લાચારીનો સંજોગ હતો. (ઉત્પત્તિ ૨૧:૧૬) આ ઉપરાંત ઉત્પત્તિના પુસ્તકમાં યાકુબનો જ્યેષ્ઠ દીકરો એસાવ પણ મોટી કારમી બૂમ પાડી રડી ઊઠે છે. એસાવના રડવાનું કારણ પિતા ધ્વારા આપાયેલ આશીર્વાદ છેતરપીંડીથી નાનો પુત્ર યાકુબ છીનવી લે છે. એ ઉપરાંત ભાઈ ધ્વારા તજાયેલો યુસુફ ભાઈઓ સમક્ષ સ્વને ઓળખાવે છે ત્યારે પોક મૂકીને રડતો જણાય છે (ઉત્પત્તિ ૪૫: ૨) ત્યારબાદ ઈસ્રાએલનું આખું નગર પોક મૂકીને રડતું આપણે જોઈએ છીએ. (૧ શમૂએલ ૪: ૧૩) કારણ દેવની હાજરીસમ કરારકોશ પલિસ્તિઓના હાથમાં જતો રહે છે. મતલબ ઈસ્રાએલમાંથી પ્રભુનું ગૌરવ ઝૂંટવાઈ ગયું છે.

આ બધા ઉપરાંત યીર્મેયાહ પ્રબોધક, દાઉદ ભક્ત, પ્રેરિત પાઉલ, બધા અવારનવાર રડતા “બાઈબલ” વાંચે છે. ગીતશાસ્ત્ર ૧૧૯: ૧૩૬માં-Page 02

દાઉદ ભક્ત ચોધાર આંસુએ રડતો, કારણ કે, પ્રભુનો નિયમ લોકો પાળતા નહોતા!
ખુદ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શાસ્ત્રમાં ત્રણ વખત રડતા વર્ણવાયા છે.

પ્રથમ વાર લાજરસની કબરની આગળ, બીજી વાર યરૂસાલેમના કપરા ભવિષ્યને કારણે અને ત્રીજી વાર ગેથસેમાની વાડીમાં છેવટની પળો ગણાઈ રહી હતી ત્યારે આંસુસહિત ઈસુ મોટે ઘોંટા રડ્યા, એ માહિતી હેબ્રી ૫: ૭માં મળી આવે છે.

આ બધા રડનારા કારણસર રડતા હતા. હાગાર તથા યુસુફ કપરા સંજોગોને કારણે રડ્યાં, જ્યારે એસાવનું રડવું એમાં એનો જ વાંક હતો-જાતે જ જ્યેષ્ઠપણું મામૂલી આહાર માટે વેચી દીધેલું! ઈસ્રાએલીઓનું કોશડરણ વખતે રડવું, એમની પોતાની બેદરકારી સ્વરૂપે હતું. પરંતુ પ્રેરિત પાઉલ, દાઉદ ભક્ત, ચીર્મેયાહ પ્રબોધક તથા ઈસુ ખ્રિસ્તનું રડવું પરહિત ખાતર હતું. બીજાના ઉત્કર્ષ માટે રડવું એ noble cause કહેવાય!

સદ્ભાવના દર્શાવતાં આંસુઓ ગીત ૫૬: ૮ મુજબ ઈશ્વરની કુખીમાં જમા થતાં રહે છે. અહીં એક શાયરી યાદ અપાવે છે;

“ગર આંસુ બહે, તો ઉસે ખૂદ હી પોંછ લેના,

ગર દૂસરોંકો આંસુ પોંછને દોગે, તો વહ તૂમસે સોદા કરેંગે!”

મિત્રો! આંસુ વહે તો ફરિયાદ કરશો નહિ. પેલું પુરાણું ગીત યાદ આવે છે?

“દિલ જલતા હૈ તો જલને દે,

આંસુ ન બહા ફરિયાદ ન કર. દિલ જલતા હૈ તો જલને દે”

માથ્થી ૫: ૪માં કહેવામાં આવ્યું છે, “શોક કરનારાઓને ધન્ય છે, તેઓ દિવાસો પામશે.” લૂક ૬: ૨૧માં કહ્યું છે, “ઓ હમણાંના રડનારાઓ તમને ધન્ય છે કેમકે તમે હસશો.”

રડો તો આત્મા જીતવા રડો! બીજાના ઉત્કર્ષ માટે રડો! પ્રભુ તમને હસાવશે. મારા ખુદના જીવનમાં એક રેલ અકસ્માતમાં ઘવાયેલ ગધેડા માટે મારી આંખે પ્રાર્થનાસહિત તેની મુક્તિ માટે આંસુ સાર્યાં છે. એક નાનું અંધ બાળક મા પાસેના પડીકામાં ફેંફોસતો જોઈ વર્ષો સુધી અંધ વ્યક્તિઓ માટે આજે પણ હૃદયપૂર્વક પ્રાર્થના કરું છું. પ્રભુને આપ્રકારનાં આંસુ, લાગણી અને પ્રાર્થના ગમે છે.

મિત્રો! બીજાનાં દુઃખ લઈ ન શકો, પરંતુ પ્રાર્થના ધ્વારા તેમનું દુઃખ હળવું થાય એવો સદ્ભાવ રાખતા રહો!

“બાઈબલ સ્ટડી”-મે-જૂન, ૨૦૧૫ના પ્રશ્નો:

વિભાગ ૧. અયુબ, હજકીયેલ, નહેમ્યાહ અને યહોશુઆનાં

પુસ્તકામાંથી

શોધીને જવાબ આપો;

પ્ર. ૧) અયુબે પોતાનો જામો ફાડીને માથું મુંડાવ્યું અને પ્રભુની સ્તુતિ કરતાં શું કહ્યું?

પ્ર. ૨) યહોવાહનું વચન હજકીયેલ પાસે આવ્યું કે, ઈસ્રાએલ દેશ વિશે કઈ કહેવત વાપરો છો?

પ્ર. ૩) કઈ ખબર સાંભળીને નહેમ્યાહ રડ્યો?

પ્ર. ૪) નહેમ્યાહનો ચહેરોઉદાસ જોઈને રાજાએ પૂછ્યું તારી અરજ શી છે?

પ્ર. ૫) મુસાના મરણ પછી યહોવાહે કોની નિમાણુંક કરી?

૬) યહોશુઆએ બે જાસુસોને કેને ત્યાં મોકલ્યા? ને તેણે કેવી રીતે તેમનો બચાવ કર્યો?

વિભાગ ૨. નિર્ગમન, ઉત્પત્તિ, ૧ શમૂએલા અને ૧ રાજના આધારે અધૂરાં વાક્ય પૂરાં કરો;

પ્ર. ૧) તું મારી લાકડી લઈને તારો હાથ _____ પાડી નાખ.

પ્ર. ૨) ફારૂને યુસુફને કહ્યું, દેવે સર્વ તને દેખાડ્યું છે, તે માટે _____ બીજો કોઈ નથી.

પ્ર. ૩) તેણે માનતા માનીને કહ્યું, જો આ તારી દાસીના દુઃખ સામે જોઈ મને વિસરીશ નહિ પણ _____ કરીશ.

પ્ર. ૪) યહોવાહે હાન્ના પર એવી કૃપા કરી કે _____.

પ્ર. ૫) તારા લોકોનો ન્યાય કરવા સારું _____ ભેદ હું પારખી શકું.

વિભાગ ૩. નહેમ્યાહ, ગીતશાસ્ત્ર અને સભાશિક્ષક આધારે ખાલી જગ્યા પૂરો;

પ્ર. ૧) ઊઠો, _____, _____, એમ તેઓએ એ _____, _____, _____, શરૂ કર્યું.

પ્ર. ૨) તમારા પિતૃઓએ _____, _____, _____, તેમ તમે _____, _____, _____, ન કરો.

પ્ર. ૩) યહોવાહે _____, _____, _____, છે, તેથી હું તેના પર _____, _____, છું.

પ્ર. ૪) જે સારું જ કરે છે અને _____, _____, _____, એવો _____, _____, _____, _____, પર એકે નથી.

પ્ર. ૫) દેવનું _____, _____ અને _____, _____ તેની દરેક મનુષ્યની _____, _____ એ છે.

અધૂરાં વાક્યો પૂરાં કરો.-(હઝકીયેલ, યુના આમોસ અને હોશિયાના આધારે)

“બાઈબલ સ્ટડી” માર્ચ-એપ્રિલ-૨૦૧૫ના પ્રશ્નોના સાચા જવાબો મોકલનાર

“બાઈબલપ્રેમી”ઓની યાદી. સૌને “અમેરિકન ક્રિશ્ચિયન ન્યુઝ”નાં અભિનંદન!

૧) ભાનુમતી ક્રિસ્ટી-કેલિફોર્નિયા ૨) રીબેકા ડાયલ-ન્યુયોર્ક

૩) લીલીયન જે. જોન-નોર્થ બર્ગન ૪) એમિલ્યા ક્રિસ્ટી-જર્સી સીટી

૫) સ્ટેલા પરમાર- નોર્થ બર્ગન ૬) શાંતાબેન રહોડ.

* “અમેરિકન ક્રિશ્ચિયન ન્યુઝ”ને મળેલાં દાનની યાદી-

-\$15/ શ્રીમતિ જોયસી ક્રિશ્ચિયન, ન્યુ જર્સી,

-\$10/ શ્રીમતિ જોયસ સોલંકી, પર્લિન,

-\$60/ એક શુભેચ્છક, -\$10/ એમિલ્યા ક્રિસ્ટી, જર્સી સીટી

-\$20/, પ્રવિણ ટેલર-બ્રુક્લિન, ન્યુયોર્ક,

-સ્ટેટન આઈલેન્ડ-સ્થિત શ્રી. મોજસ એમ પરમાર તરફથી તેઓની દીકરી સ્વ.

વિનિફ્રેડ રાહોડની શ્રદ્ધાંજલિરૂપ ૨૦ યુએસ પોસ્ટલ સ્ટેમ્પ્સની ત્રણ બૂકો દાનમાં મળી છે.

“અમેરિકન ક્રિશ્ચિયન ન્યુઝ” ઉદારદિલ દાતાઓનો હાર્દિક આભાર માને છે! દાન

ફક્ત શ્રીમતી રૂથબેનના સરનામે મોકલવાં. તંત્રીના સરનામે કોઈ દાન સ્વીકારવામાં આવશે નહિ, તેની નોંધ લેવી.

મે માસ-“ખ્રિસ્તી કુટુંબનો મહિનો”- રેવ. સ્નેહલતા એ. પટેલ (બ્રુક્લિન, ન્યુયોર્ક)

વર્ષનો પ્રત્યેક મહિનો જુદા જુદા વિષયો ઉપર કેન્દ્રિત કરતાં, તેની વિવિધ પ્રકારે ઉજવણી કરવામાં આવે છે. જેમકે, ફેબ્રુઆરી મહિનો Black History Month- તરીકે ઉજવવામાં આવે છે. તો મે મહિનો Christian Home Month- Families: Called to Justice-ખ્રિસ્તી ઘરકુટુંબ તરીકે ઉજવાય છે.

જ્યારે રાષ્ટ્રીયસ્તરે Older Americans Month-સીનિયર્સ મંથ-તરીકે ઉજવાય

વિશ્વ, રાષ્ટ્ર, રાજ્ય, નગર, સમાજ, વગેરે કુટુંબરૂપી એકમનો બનેલો છે.

કુટુંબ તરીકે ઉજવાતા ધાર્મિક સ્વરૂપના આ તહેવાર, જેમ મકાનની બાંધણીમાં ઈંટ એકમ ગણાય છે અને મકાનની મજબુતાઈ પ્રત્યેક ઈંટ ઉપર રહેલી છે તે જ પ્રમાણે; વિશ્વ, રાષ્ટ્ર, રાજ્ય, નગર, સમાજ, વગેરે કુટુંબરૂપી એકમનો બનેલો છે. સમાજમાં

ગુનહાખોરી, હિંસાવૃત્તિ, બદકેલી, વગેરેના પ્રમાણનો આધાર કૌટુંબિક જીવન ઉપર રહેલો છે. વિશ્વની સ્થિરતામાં મહામૂલો ફાળો આપવાની ખ્રિસ્તિ ઘરકુટુંબ પાસે મહામૂલી તક છે. તેથી આ લેખમાં હું ત્રણ બાબતો તરફ વાચકમિત્રોનું ધ્યાન કેન્દ્રિત કરું છું;

૧. ખ્રિસ્તી ઘરકુટુંબ સમાજથી માંડી વિશ્વની સ્થિરતા જાળવવામાં અસરકારક યોગદાન આપી શકે છે. કોઈ લેખકે સાચેજ કહ્યું છે કે, આ પૃથ્વી પર સ્વર્ગની જો કોઈ તદ્દન નજીક હોય તો તે ઘર-કુટુંબ છે. આ કુટુંબમાં માતાપિતાની છત્રછાયામાં બાળકો ફૂંફ, પ્રેમ અને સલામતીનો અનુભવ કરે છે. અને કુટુંબમાં -Page 03

અનુભવાતી આ સલામતી વિશ્વની સલામતી અને પ્રગતિમાં ફાળો આપે છે. તે સાથે વિધિની વક્તા પણ એ છે કે, નરકની નજીક જો કોઈ હોય તો તે પણ કુટુંબ છે! જ્યાં અવિશ્વાસ, અસલામતી, ડર પ્રેમ અને હુંફનો અભાવ પ્રવર્તે છે, પરિણામે આવાં કુટુંબો સ્વસ્થ સમાજ માટે ખતરારૂપ બને છે. ખ્રિસ્તી ઘરકુટુંબની ઉજવાણી કુટુંબની સ્થિરતા પર ભાર મૂકે છે. ખ્રિસ્તી કુટુંબોને આત્મપરીક્ષણ કરતાં ખ્રિસ્ત પ્રભુ ઉપરના વિશ્વાસમાં દૃઢ થવા તક પૂરી પાડે છે.

“o blest that House where faith you find; And all within have set other mind; To Trust their God, and Serve Him Still, And do each other day His Holy Will.” (Annonymus writer.)

૨. નમૂનારૂપ જીવન: ઘણીવાર બાળકો માતાપિતાની શીખામણ પ્રત્યે ભલે આંખાઆડા કાન કરે, પણ તેઓ વડિલો અને માતાપિતાની જીવનશૈલી તરફ આંખો ખુલ્લી રાખે છે. માતાપિતા સિવાય સ્કૂલ, સમાજ, મિત્રો, જાહેર માધ્યમો, વગેરે પણ બાળકના જીવનઘડતરમાં અગત્યનો ફાળો આપે છે.

તેથી ‘હું બાળકને કેવી રીતે સફળ બનાવું’ તેના કરતાં ‘હું કેવી રીતે આદર્શ અને પ્રભુનો ભય રાખી જીવન જીવનાર વાલી બની શકું’ તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. આપણે અન્યને નિયંત્રિત કરી શકતા નથી, તેથી પોતાના જીવનને માટે આપણે નિમ્નવિખિત જેવી દૈનિક પ્રાર્થનાની તાતી જરૂર છે;

Prayer: *“Lord, Help me to be, what you want me, To be in character, Actions and Will, for you are the Potter. And we are the clay, Your Purposes we will fulfill.” –Fitzhugh.*

૩. શ્રેષ્ઠ વારસો: ખ્રિસ્તને અર્થે જીવાયેલું જીવન.

માતાપિતા તરફ આપણાં બાળકો માટે મહામૂલો વારસો મૂકી જવાની આપણી ઝંખના હોય છે. તેમાં કશું ખોટું નથી, પણ તેના કરતાં વધુ આવશ્યકતા બાળકોને આત્મિક વારસો, જે તેઓને અનંતજીવન તરફ દોરી જાય તે વારસો આપવાની જરૂરિયાત મોટી છે. આ શ્રેષ્ઠ વારસો મૂલ્ય આપીને ખરીદી શકાય નહિ, તેથી ખ્રિસ્તી માતાપિતા તરફ આપણે જીવનના પ્રત્યેક સંજોગોમાં ઈશ્વર ઉપર અવલંબન રાખવાની જરૂર છે. જે કુટુંબમાં પ્રાર્થનાની વેદી સળગતી રહે છે તે કુટુંબ હંમેશાં સાથે રહે છે. આપણુ દરેક વ્યક્તિ આત્મપોષ કરતાં પોતાને પ્રશ્ન પૂછીએ; શું હું મારા વડાલાઓ અને સ્નેહીઓને માટે અનંતજીવનના વારસાની ભેટ આપતો જાઉં છું કે કેમ? કારણ કે,

“Faithful Parents never carve their name on Marble. Colomns, built for earthly fame; They build instead a Legacy that springe out of a life, lived for King of Kings.”-Gustafson

Have a Happy & Blessed Celebration of the Christian Home!

* **Visa, OCI,** અને “ભારતીય પાસપોર્ટ” ‘કેન્સલ’ કરાવવા માટેની **Renunciation services** ‘આઉટ સોર્સ’ની કંપનીમાં **May 21, 2014**થી સોંપવામાં આવેલ છે ત્યારથી આ અંગે પૂછપરછના અનેક ફોન આવતા હોય છે. જેથી આ અંગેની જરૂરી અને અતિ અગત્યની માહિતી ટૂંકમાં રજૂ કરી છે;

Visa-વિઝા, OCI Overseas Citizen of India-ઓસીઆઈ અને **Indian Passport-“ભારતીય પાસપોર્ટ” ‘કેન્સલ’** કરાવવા માટેની એજન્સી છે- **Cox and Kings Global Services Pvt. Ltd.**

જેની વેબ સાઈટ નોંધી રાખશો:-www.in.ckgs.us અને

આ એજન્સીની ઓફિસનું સરનામું છે:-

Global Services Pvt. Ltd.

2nd Floor, 235 West

23rd Street, New York-10011. અને

વિઝા, ‘ઓસીઆઈ’ અને “ભારતીય પાસપોર્ટ” ‘કેન્સલ’ કરાવવા અંગે

enquiriesusa@ckgs.com ઉપર પૂછપરછ-તપાસ કરી શકાય અથવા ફોન

નંબર **646-589-0088** અને **516-206-1483** ઉપર પણ પૂછી શકાય.

“ભારતીય પાસપોર્ટ” અંગે ‘આઉટ સોર્સ’ની કંપની-એજન્સી છે:-

BLS International Services Ltd. “ઈન્ડિયન પાસપોર્ટ” રી-ન્યૂ કરવવા, નામમાં ફેરફાર કરવવા, વગેરે-ફક્ત “ભારતીય પાસપોર્ટ” અંગેની કાર્યવાહી માટે આ એજન્સીનો સંપર્ક સાધવો.

આ એજન્સીની ઓફિસનું સરનામું છે:-

BLS International Services Ltd.

28 West 30th Street, Suite 202,

New York, NY 10001

આ એજન્સીનો સંપર્ક સાધવા માટેની

‘હેલ્પ લાઈન-Helpline: +18459990726 છે અને

ઈ-મેલ એડ્રસ E-mail: newyork@blsgroup.in છે. જ્યારે તેની વેબ સાઈટ

છે:-Website: <http://www.passport.blsindia-usa.com/>

* ભારત સરકારે વિદેશીઓને ભારતની મુલાકાત માટે પ્રવેશ સમયે જ- Tourist Visa-on-Arrival-ની સવલત નવેમ્બર ૨૭, ૨૦૧૪થી અમલમાં મૂકી છે, આ પ્રકારના વિઝા જે દેશોને માટે મંજૂર કરેલા છે તેવા દેશો વધતા જાય છે. અદ્યતન માહિતી મુજબ નીચેના દેશોને આ સવલતનો લાભ મળી શકે છે;

Australia, Brazil, Cambodia, Cook Islands, Djibouti, Fiji, Finland, Germany, Indonesia, Israel, Japan, Jordan, Kenya, Kiribati, Laos, Luxembourg, Marshall Islands, Mauritius, Mexico, Micronesia, Myanmar, Nauru, **New Zealand**, Niue Island, Norway, Oman, Palau, Palestine, Papua New Guinea, Philippines, Republic of Korea, Russia, Samoa, **Singapore**, Solomon Islands, Thailand, Tonga, Tuvalu, UAE, Ukraine, **USA**, Vanuatu, Vietnam.

ભારતમાં પ્રવેશ સમયે જ વિઝામંજૂરીનો લાભ વ્યક્તિગત વધુમાં વધુ ૩૦ દિવસના રોકાણ માટે હશે, જે ભારતમાં પ્રવેશ કર્યાના દિવસ સાથે ૩૦ દિવસ ગણાશે. હાલ ભારતનાં નીચે જણાવેલ ૮ ‘એરપોર્ટ’ ઉપર જ આ નવી સવલત ઉપલબ્ધ રહેશે; Bangalore, Chennai, Cochin, Delhi, Goa, Hyderabad, Kolkata, **Mumbai & Trivandrum**. (નોંધ:-આ યાદીમાં હાલમાં તો ‘અમદાવાદ’ એરપોર્ટ નથી, જેથી આ નવી સવલતમાં ગુજરાતની મુલાકાત લેનાર ઉપરોક્ત વિદેશો (આપણે યુએસએ સીટીઝનોએ)ના મુલાકાતીઓએ-અમદાવાદ એરપોર્ટનું નામ પણ ઉમેરાય તે માટે જોરદાર માંગણી કરવી જોઈએ)

Emergency Visa-ઈમર્જન્સી વીઝા-Entry Visa (X)-એન્ટ્રી વીઝા:-જેઓ મૂળભૂત ‘ઈન્ડિયન પાસપોર્ટ’ ઉપર વિદેશ (યુએસએ)માં રહીને યોગ્ય સમયે જરૂરી લાયકાત મુજબ જે તે દેશ (યુએસએ)ની ‘સીટીઝનશીપસ્વીકારેલી હોય તેઓને ખાસ સંજોગોમાં-પોતાનાં સ્વજન કે સગાંસંબંધીના અચાનક ‘મૃત્યુ’ કે ગંભીર બિમારી, જીવલેણ અકસ્માત જેવી કમનસીબ ઘટના, વગેરે સંજોગોમાં તત્કાલિન ઈન્ડિયા જવા માટેના આ પ્રકારના વીઝા વધુમાં વધુ ૬ મહિનાની જેટલી ટૂંકી મુદત માટે મળી શકે છે.

આ પ્રકારના **Emergency Visa-ઈમર્જન્સી વીઝા-Entry Visa (X)-એન્ટ્રી વીઝા** મેળવવા ‘ઓનલાઈન અરજી’ કરવા માટેની વેબસાઈટ છે;

(<https://indianvisaonline.gov.in/visa/>) ‘ઓનલાઈન અરજી’ ભરીને તે લઈને ૩૫૩ નજીકની ‘ઈન્ડિયન કોન્સ્યુલેટ જનરલ’ની ઓફિસમાં જવાથી આ પ્રકારના **short-term Entry visa (X)-Entry Visa (X)** મળી શકે છે .

‘ઈન્ડિયન કોન્સ્યુલેટ જનરલ’ની ઓફિસનો ટાઈમ-સોમથી શુક્ર સુધીના કામના દિવસો દરમિયાન સવારના ૯થી બપોરના ૧૨ સુધી અને શનિવારે સવારના ૧૧થી બપોર બાદ ૧ વાગ્યા સુધીનો હોય છે. આ પ્રકારના અરજીદોર્મ સાથે જરૂરી-યોગ્ય ‘ઓરિજિનલ ડોક્યુમેન્ટ’ રજૂ કરવાથી ‘વીઝા’ અંગેની કાર્યવાહી થયા બાદ સાંજના ૪ વાગે ‘વીઝા મંજૂરી’ મળવાપાત્ર બને છે. આ પ્રકારના વીઝા મેળવવા નીચેનાં ‘ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ’ રજૂ કરવાં;

-‘ઓનલાઈન અરજી’ ભરેલું અરજીફોર્મ,
 - (2 x 2) ઈંચનો એક કલર ફોટો,
 -અરજદારના રહેઠાણના સરનામાની પૂરાવા-યુટીલીટી બીલ, ડ્રાઈવિંગ લાયસન્સ,
 -ઈમર્જન્સી-જેમકે, સ્વજનનું અકાળે મૃત્યુ અંગેના પૂરાવા, જીવલેણ-ગંભીર બિમારી, વગેરે.
 -અરજદાર ભારતના મૂળભૂત નાગરિક હોવાના પૂરાવા,
 -અરજદારની ઈન્ડિયા જવા માટેની અધિકૃત વિમાનની ટિકિટ,
 -વીઝા ફી \$203.00 કેશ. ઉપરાંત
 -જો અરજદાર મૂળભૂત ‘ભારતીય નાગરિકતા’ ધરાવનાર હોય તો...પોતે ‘ઈન્ડિયન સીટીઝનશીપ’ તરછોડી હતી, ત્યારનો પોતાનો ‘ઈન્ડિયન પાસપોર્ટ’ ‘કેન્સલ’ કરાવીને તે અંગેનું સર્ટિફિકેટ રજૂ કરવું, અને
 - પોતે યુએસ સીટીઝન હોવા અંગેનું ‘અમેરિકન સીટીઝનશીપ સર્ટિફિકેટ, ની કોપી અથવા
 પોતાનો જૂનો ‘યુએસ પાસપોર્ટ’ રજૂ કરવો.
 જો અરજદાર સગીર-૧૮ વર્ષથી ઓછી ઉંમરના હોય તો નીચેના પૂરાવા રજૂ કરવા;
 -માતા-પિતા બંનેની સહી ‘વીઝા ફોર્મ’માં કરેલી હોવી જરૂરી, જે ‘નોટરાઈઝ’ કરેલી હોવી જોઈએ,
 -માતા-પિતા બંનેના ‘પાસપોર્ટ’ની કોપી,
 -અરજદારના જન્મ તારીખનો દાખલો,
 -અરજદાર મૂળભૂત ભારતીય નાગરિકતા ધરાવનાર હોવાના પૂરાવા,
 -ઈમર્જન્સી હોવા અંગેના પૂરાવા,
 -ઈન્ડિયા જવા માટેની અધિકૃત વિમાની ટિકિટ,
 -અરજીફોર્મ સાથે તમામ પૂરાવા અને જરૂરી વીઝા ફીની રકમ.
 ઉપરોક્ત તમામ વિગત ભારતીય કોન્સ્યુલેટની ‘વેબસાઈટ’ ઉપરથી તાજેતરની માહિતી મુજબ સરળ ગુજરાતી ભાષામાં રજૂ કરવામાં આવેલી છે, જે અંગે ‘વેબ સાઈટ’ની અદ્યતન માહિતી જ આખરી અને સાચી ગણવી.
 * OCI અને PIO અંગે હજી ઘણી ગેરસમજ એ યોજનાના લાભાર્થીઓમાં હોવાનું જણાય છે. હવે એક જ યોજના OCI છે. જૂનું PIO હોય તેઓએ OCI માં પરિવર્તન કરાવી લેવું. **OCI આજીવન-લાઈફ ટાઈમ-જીવો ત્યાં સુધી હોય છે.** ઉપરની વિગત ‘ઈન્ટરનેટ’ ઉપરથી મેળવી, લેખકની સમજ અને અર્થઘટન મુજબ રજૂ કરેલ છે, જે વિશ્વસનીય હોવા છતાં તેના ઉપયોગ અંગે તંત્રી, પ્રકાશક કે લેખક જવાબદાર નથી.

“ફૂડ સ્ટેમ્પ્સ પ્રોગ્રામ:-તાજેતરમાં ફૂડ સ્ટેમ્પ્સના લાભાર્થીઓના ફોન ફરિયાદ કરતા હોય તેવા આવતા હોય છે, ઘણા આવતા હોય છે. સ્વાભાવિક છે કે, દર મહિને મળતી આ યોજના મુજબની રકમ કપાત કરીને ઘટાડી દેવામાં આવી છે, મહિને ઘણી જ ઓછી રકમ હવે મળે છે. શું કરવું? અપીલ કરવી? ફોન કરવો? રકમ વધારવા નજીકની હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસ”ની ઓફિસે રૂબરૂ જવું? વગેરે.

“ફૂડ સ્ટેમ્પ્સ પ્રોગ્રામ” અમલમાં આવ્યાં ૫૦ વર્ષ પૂરાં થયાં છે. સને ૧૯૬૪માં તે સમયના અમેરિકાના પ્રમુખશ્રી લિન્ડન જોન્સને સહી કરીને “ફૂડ સ્ટેમ્પ્સ એક્ટ” અમલી બનાવ્યો હતો.

સને ૨૦૦૮ની ૧ લી ઓક્ટોબરથી આ યોજનાને નવું નામ આપવામાં આવ્યું છે, જે મુજબ આ પ્રોગ્રામ હાલમાં Supplemental Nutrition Assistance Program (SNAP)-આ યોજના ‘સ્નેપ’ તરીકે પણ ઓળખાય છે. ‘સ્નેપ યોજના’ અમેરિકાની મોટામાં મોટી યોજના ગણાય છે.

તાજેતરની છેલ્લામાં છેલ્લી ફેબ્રુઆરી, ૨૦૧૫ની માહિતી મુજબ અમેરિકાના ૪૫.૬ મિલિયન (૪૫૬ લાખ) લોકોએ આ યોજનાના લાભાર્થીઓ હતા. United States Department of Agriculture (USDA)-આ યોજનાનો વહીવટ સંભાળે છે. આ યોજના માટે ભાગીદારી માટે અરજી કરતા તમામ લાયક

ઘરોમાં માટે ખોરાક ખરીદ શક્તિ વધારીને તેઓને ભૂખમરાથી બચાવવા અને ખોરાકના અભાવે કુપોષણના ભોગ બનતાં આટકાવવા-ભૂખમરો દૂર કરવા આ યોજના મહત્વપૂર્ણ અને લોકપ્રિય બની રહી છે.

આ યોજના જીવનનિર્વાહ સંબંધી મહત્વપૂર્ણ મદદ છે.

ઓછી કે બીલકુલ આવક ન હોય, વિકલાંગ-અપંગ, વયસ્ક-સીનિયર સીટીઝન, બાળકો અને જરૂરિયાતમંદોને સહાયરૂપ આ યોજના દર મહિને જીવનનિર્વાહ માટે નિયત કરેલા ખોરાકની ખરીદવા માટે રોકડ રકમ ફાળવવામાં આવે છે.

માસિક રકમ આમ તો રોકડ કહેવાય છે, પણ ‘ફૂડ સ્ટેમ્પ્સ’ના લાભાર્થીના હાથમાં આ રકમ આવતી હોતી નથી, બલકે-Through the electronic benefit transfer systems (EBT)-મુજબ ‘ક્રેડિટકાર્ડ’ની માફક પ્લાસ્ટીકના કાર્ડ મારફતે નિયત કરેલો ખોરાક ખરીદવા માટે મશીન મારફતે ચૂકવાય છે.

લાભાર્થીના આ EBT કાર્ડના ખાતે જે તેની નિયત તારીખે નક્કી થયેલી રકમ જમા થતી હોય છે. અને આમ આ યોજના મર્યાદિત આવક ધરાવનારાઓને ઘણી જ રાહતરૂપ બને છે.

વોશિંગ્ટન ડીસી અને પોર્ટુગલ સહિત અમેરિકાનાં ૫૦ સ્ટેટમાં આ યોજનાને ‘ફેડરલ ગવર્નમેન્ટ’ અનુદાન પૂરું પાડે છે. આ યોજનાનો વહીવટી ખર્ચ જે તે સ્ટેટ ભોક્ષે છે, પરંતુ વહીવટી ખર્ચનો ૫૦% હિસ્સો ‘ફેડરલ ગવર્નમેન્ટ ભોગવે છે.

દર પાંચ વર્ષે ‘કોંગ્રેસ’-સંસદ ‘ફૂડ સ્ટેમ્પ્સ પ્રોગ્રામ’નો કાયદો ‘ફાર્મ બીલ’ તરીકે તાજો કરીને કાયદાનું સ્વરૂપ આપે છે. આથી દર પાંચ વર્ષે આ કાયદામાં સુધારા-વધારા થતા રહે છે અને ‘ફૂડ સ્ટેમ્પ્સ’ મેળવવાની લાયકાતમાં પણ નાન-મોટા ફેરફારો થતા રહે છે.

The U.S. Department of Agriculture દર વર્ષે ‘ફૂડ સ્ટેમ્પ્સ યોજના’ને વધુ ધ્યેયલક્ષી બનાવવા કાયદાની સરાહના કરીને તથા યોજનાનું સ્તર વધુ પ્રજાને સહાયરૂપ થાય તે માટે સંશોધન કરે છે.

“ફૂડ સ્ટેમ્પ્સ”-‘સ્નેપ’ મેળવવાની પાત્રતામાં વ્યક્તિ કે પરિવાર અને કોઈ સગા ન હોવા છતાં સાથે રહેતા જૂથની માસિક-વાર્ષિક આવક મુખ્ય ભાગ ભજવે છે.

આવક મર્યાદા ‘ફેડરલ ગવર્નમેન્ટ’ની દર વર્ષે જાહેર થતી ‘ગરીબીરેખા’ મુજબ ૧૦૦% થી ઓછી યોજ્જની ૧૩૩% આવક ધરાવનારને અન્ય યોગ્યતાને આધારે આ યોજનાના લાભ મળી શકે છે. વિકલાંગ, ‘ડિસએબીલીટી ધરાવનાર, સીનિયર સીટીઝન, Supplemental Security Income (SSI) મેળવનાર અને બેંકમાં બંધું મળીને નાણાંનો ‘સોર્સ’-સીંગલ માટે \$2,250 અને કપલા માટે \$3,250 હોવા જરૂરી.

માર્ચ, એપ્રિલ, મે અને જૂન-2015 વિઝા બુલેટીન

ફેમિલિ કેટેગરી	માર્ચ-2015	એપ્રિલ-2015	મે-2015	જૂન-2015
F-1	01 Aug-07	01 Aug-07	15 Aug-07	01 Sep-07
F-2 A	22 Jun-13	01 Aug-13	01 Sep-13	01 Oct-13
F-2 B	08 July-08	22 Aug -08	15 Sep -08	15 Sep -08
F-3	22 Jan-04	08 Feb-04	22 Feb-04	22 Feb-04
F-4	15 May-02	15 Jun-02	01 Aug-02	08 Sep-02

પાછળના ત્રણ મહિનાની વિગતના આધારે પાંચે કેટેગરી દર માસે આગળ વધે છે કે નહિ? વધે છે તો કેટલી તે જાણીને વિઝા ક્યારે નીકળશે તેનો અંદાજ કાઢી શકાય. ઉપરોક્ત કોઠા મુજબ જૂન-2015ની વિઝાની વિગત નીચે મુજબ છે:-

F-1-અમેરિકન સીટીઝનનાં સગીર સંતાનો અને 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનાં અપરણિત સંતાનો-01 September-2007 (આ મહિને 17 દિવસ આગળ વધી છે)

નોંધ: (યુએસ સીટીઝનનાં પતિ/પત્ની, યુએસ સીટીઝનનાં 21 વર્ષથી ઓછી ઉંમરનાં અપરણિત સંતાન, યુએસ સીટીઝનનાં માતા/પિતાને નિકટતમ કુટુંબજન તરીકે તત્કાલીન વિઝા મળે. માસિક/વાર્ષિક વિઝા-કવોટા મર્યાદા લાગુ પડતી નથી)

F-2 A ગ્રીનકાર્ડધારકનાં પતિ/પત્ની અને 21 વર્ષથી ઓછી ઉંમરનાં અપરણિત સંતાનો-01 October-2013 (આ મહિને 30 દિવસ આગળ વધી છે)

F-2 B - ગ્રીનકાર્ડધારકનાં 21વર્ષ કે વધુ ઉંમરનાં અપરણિત સંતાનો- -Page 05

15 September-2008 (ગયા મહિને હતી ત્યાંથી આગળ વધી નથી)

F-3-અમેરિકન સીટીઝનનાં પરણિત સંતાનો-22 February-2004 (ગયા મહિને હતી ત્યાંથી આગળ વધી નથી, યુએસ સીટીઝન માબાપ માઠા સમાચાર)

F-4-US સીટીઝનનાં ભાઈ/બેન, ઓરમાન ભાઈ/બેન-01 August-2002 (ગયા મહિનાથી 38 દિવસ આગળ વધી છે, જે ભાઈ-બેન માટે સારા સમાચાર) uscis.gov વેબ સાઈટની છેલ્લામાં છેલ્લી માહિતી આખરી ગણવી ઉપરોક્ત બુલેટીન મુજબ જો આ મહિને ફાઈલ કરવામાં આવે તો..

F-1 માટે 7 વર્ષથી વધુ રાહ જોવી પડે. F-2 A હવે છેલ્લા 4 મહિનાથી આગળ જાય છે, તેથી 2થી 3 વર્ષથી વધુ રાહ જોવી પડશે. F-2 B માટે 7 વર્ષ 6 મહિના રાહ જોવી પડે. F-3 માટે 12 વર્ષથી વધુ રાહ જૂઓ અને F-4 માટે 13-14 વર્ષ રાહ જોવી પડે, F-3 જે પરણિત સંતાનની માતા કે પિતાએ કરેલી ફાઈલના કરતાં F-4-જે ભાઈ કે બહેને પોતાના ભાઈ કે બહેન માટેની ફાઈલ વહેલી આગળ વધે છે. ‘બલડ રીવિઝન’-લોહી સંબંધ પતિ/પત્ની, ભાઈ/બેન, સંતાનો, માતા/પિતાની-ફેમિલી કેટેગરીની બધી ફાઈલો ચાલુ જ છે.

વિઝા ફી ચૂકવી હોય તો કશી રાહ જોયા વિના સ્પોન્સરશીપનાં પેપરો યુએસ વિઝા સેન્ટરમાં મોકલી દેવાં પણ વિઝાકોવ આવ્યા બાદ સગાંને મોકલવાં હિતાવહ છે.

રોજગાર આધારિત વીઝા બુલેટીન જૂન-2015

કેટેગરી	અગ્રતા તારીખ	ગયા માસથી આગળ/પાછાળ
E 1-નિમ્ણાત કામદારો	તત્કાલ	વર્તમાન
E 2- ધંધાકીય ડીગ્રીધારકો	01 October-2008	22 અઠવાડિયાં આગળ
E 3- કુશળ કારીગરો	22 January 2004	1 અઠવાડિયું આગળ
E W-અન્ય કામદારો	22 January 2004	1 અઠવાડિયું આગળ
E 4- ચોક્કસ પ્રકારના વસાહતીઓ	તત્કાલ	વર્તમાન
E 5-રોજગારી ઉત્પન્ન કરનારા	તત્કાલ	વર્તમાન
ધાર્મિક વ્યક્તિઓ	તત્કાલ	વર્તમાન

* અમેરિકામાં રહેતા જે કોઈ ખ્રિસ્તી ભાઈ/બેનને American Christian News નિયમિત મેળવવાની ઈચ્છા હોય તો પોતાનું પોસ્ટલ અથવા ઈ-મેઈલ એડ્રસ, તંત્રીશ્રીને મોકલવા વિનંતી!

તંત્રીનું સરનામું અને ઈ-મેઈલ નોંધી રાખશોજી!

Editor-ACN,

144 Strawberry Hill Ave, Woodbridge, NJ 07095

Phone: 732-855-0596 * Email: jospausa@yahoo.com

* ખાસ સૂચના:- American Christian News (ACN) માં પોતાના લેખ પ્રસિધ્ધ કરવાની ઈચ્છા ધરાવનારે પોતાનાં તમામ લખાણ સીધાં જ તંત્રીશ્રીના સરનામે મોકલવાં. કેટલાક માનનીય શ્રીમતી રૂથબેન ક્રિશ્ચિયનના સરનામે મોકલે છે, તેથી લેખક પોસ્ટલ સ્ટેમ્પસનો ખર્ચ કરે, અને રૂથબેન એ જ લેખ તંત્રીને મોકલવા ફરીથી પોતે પોસ્ટલ સ્ટેમ્પસ ખર્ચે, આમ ડબલ ખર્ચ થાય, વળી લેખ તંત્રીને મળતાં બમાણો સમય જાય, તે ઠીક નથી. દર બે મહિને પ્રસિધ્ધ થતા American Christian New માટેના લેખ-લખાણો નવેમ્બર મહિનાની ૧૫-૨૦ તારીખ સુધીમાં બારોબાર તંત્રીને મોકલીને સહકાર આપવા વિનંતી! -લખાણની શરૂઆતમાં લેખકે પોતાનું નામ, સરનામું અને ફોન નંબર અને જો હોય તો ઈ-મેઈલ એડ્રસ સાથે લેખ મોકલ્યાની તારીખ અચૂક લખવી.

From:-AMERICAN CHRISTIAN NEWS

Community Paper soliciting your Co-operation

I.D. # 11-2917985 August 28, 1988

“Gujarati Christian Church”

17, Dart Mouth Ave, Avenel, NJ 07001-1804

Phone # (732) 750-4064-(Ruthben Christian)

-“ભાઈબલ સ્ટડી”ના જવાબો શ્રીમતી રૂથબેન ક્રિશ્ચિયનને સરનામે મોકલવા.

-આપનાં દાન ફક્ત રોકડમાં પોસ્ટલ સ્ટેમ્પસ માટે શ્રીમતી રૂથબેન ક્રિશ્ચિયનને સરનામે મોકલવાં.

-“અમેરિકન ક્રિશ્ચિયન ન્યુઝ”માં પ્રસિધ્ધ થતાં લખાણો અંગે જે તે લેખક જવાબદાર રહેશે.

નીચેની બૂકો “અમેરિકન ક્રિશ્ચિયન ન્યૂઝ”ના વાચકો માટે ઓછા દરે ખરીદી શકાય છે; (1) “અમેરિકામાં સીનિયરોને મળતા લાભો”-\$13.00 (શીપિંગ સહિત),

(2) “યુએ સીટીઝનશીપ ગાઈડ”-\$10.00, (શીપિંગ સહિત), યુએસ સીટીઝનશીપ મેળવવા માટે નવા N-400 ફોર્મની સમજ અને હવે 21 પાનના નવા ફોર્મ અંગેના પ્રશ્નોત્તર સાથે અદ્યતન 2014ની નવી આવૃત્તિ.

(3) “ડ્રાઈવિંગ ઈન યુએસએ ટેસ્ટ ગાઈડ” (અમેરિકાનાં 50 સ્ટેટ્સ માટે)-\$7/ (શીપિંગ સહિત)નો ચેક Josh Foundation નામે લખીને એક ચિઠ્ઠીમાં નામ, સરનામું અને ફોન નંબર લખીને કઈ બૂક મંગાવવી છે તે લખીને-Josh Foundation, 144 Strawberry Hill Ave, Woodbridge, NJ 07095 સરનામે મોકલ્યા પછી બે વીકમાં આપને બૂક ન મળે તો જ ફોન કરશો. રજીસ્ટર મેઈલ કરવી નહિ.

1) “Perfection is not attainable. But if we chase perfection, we can catch excellence.” -- Vince Lombardi, Head Coach Green Bay Packers (1959-67)

2) “Leadership is a matter of having people look at you and gain confidence...If you're in control, they're in control.” -- Tom Landry, Head Coach Dallas Cowboys (1960-88)

3) “On a team, it's not the strength of the individual players, but it is the strength of the unit and how they all function together.” -- Bill Belichick, Head Coach New England Patriots (2000-Present), New York Jets (1999), Cleveland Browns (1991-95)

4) “If you want to win, do the ordinary things better than anyone else does them day in and day out.” -- Chuck Noll, Head Coach Pittsburgh Steelers (1969-91)

5) “Leaders are made, they are not born. They are made by hard effort, which is the price which all of us must pay to achieve any goal that is worthwhile.” -- Vince Lombardi, Head Coach Green Bay Packers (1959-67)

લાઈફ ઈઝ બ્યુટીફૂલ પણ એ સુંદરતા સ્વીકારવાની તમારી તૈયારી છે?

જિંદગીને નજીકથી જુઓ, એ ધીમે ધીમે સરકી રહી છે,

અને એને જીવી લોકારણ કે એ સરકી જવાની છે.

જિંદગી વિશે બધું વિચારવાની પણ જરૂર નથી, કારણ કે

અલ્ટિમેટલી જિંદગી એ વિચારવાનો નહીં પણ જીવવાનો વિષય છે

I don't believe people are looking for the meaning of life

As much as they are looking for the

Experience of being Alive...!! • • •

To,